



ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી

(આઈ. એસ. ઓ. ૯૦૦૧:૨૦૧૫ પ્રમાણિત સંસ્થા),

"સંહતિ", છઠ્ઠો માળ, એસ.આઈ.ઈ.સી.સી. કેમ્પસ, ખજોદ ચાર રસ્તા પાસે, અલયાણ રોડ, સરસાણા, સુરત - ૩૯૫ ૦૦૭

ફોન નં. ૨૨૮૧૧૧૧૧

ફેક્સ નં. ૦૨૬૧-૨૪૭૨૩૪૦

E-mail : info@sgcci.in

Website : www.sgcci.in

Ref no. PN 2025-26/304

Dt. 20/01/2026

તંત્રીશ્રી, _____, સુરત.

મે. સાહેબશ્રી,

જત નીચેની પ્રેસ નોટ આપના દૈનિકમાં પ્રસિદ્ધ કરી આભારી કરશોજ.

લિ.

આપનો વિશ્વાસુ,

(સેક્રેટરી)

આંતરરાષ્ટ્રીય વેપારમાં કાર્ગોની સુરક્ષા માટે મરીન ઇન્શ્યોરન્સ અનિવાર્ય: ચેમ્બર દ્વારા માહિતીસભર સેમિનાર યોજાયો

જહાજ કે કાર્ગોના બચાવ કાર્ય માટે ચૂકવાતા 'સાલ્વેજ ચાર્જીસ' પણ મરીન પોલિસીમાં કવર થાય છે; સુએઝ કેનલના બ્લોકેજનું અપાયું ઉદાહરણ

વીમો એ વિશ્વાસનો કરાર છે, 'અટમોસ્ટ ગુડ ફેથ'નો સિદ્ધાંત પાળવો દરેક
વીમેદારની ફરજ: નિષ્ણાત વક્તા શ્રી પુનિત પંડ્યા

સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા, તા. 17 જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ સાંજે 5:30 કલાકે, ઉષાકાંત મારફતિયા હોલ, સરસાણા, સુરત ખાતે 'મરીન ઇન્શ્યોરન્સ એન્ડ ક્લેઈમ્સ: સેફગાર્ડિંગ યોર કાર્ગો/સિક્યોરિંગ યોર બિઝનેસ' વિષય પર એક અત્યંત માહિતીપ્રદ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધ ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડના ડિવિઝનલ મેનેજર શ્રી પુનિત પંડ્યાએ કાર્ગો ઇન્શ્યોરન્સ કેવી રીતે લેવો, પોલિસીના પ્રકારો અને જો નુકસાન થાય તો ક્લેઈમ સેટલમેન્ટની પ્રક્રિયા કેવી રીતે સરળ બનાવી શકાય તે અંગે વ્યવહારુ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ચેમ્બરના માનદ મંત્રી શ્રી બિજલ જરીવાલાએ સ્વાગત સંબોધનમાં કહ્યું કે, ચેમ્બર વર્ષમાં 300થી વધુ આવા માહિતીસભર અને જ્ઞાનસભર કાર્યક્રમો યોજે છે. સુરત હવે નિકાસનું હબ બનતું જાય છે ત્યારે આ કાર્યક્રમનું વિશેષ મહત્વ છે.

મુખ્ય વક્તા શ્રી પુનિત પંડ્યાએ કહ્યું કે, દેશમાં વીમાની પહોંચ વધારવા સરકાર સતત પ્રયત્નો કરી રહી છે. આંતરરાષ્ટ્રીય વેપાર શરૂ થયો ત્યારથી દરિયાઈ વીમો ચાલતો આવ્યો છે. મરીન વીમા માટે સંસદે વિશેષ એક્ટ પણ પસાર કર્યો છે. તેની મહત્વની જોગવાઈઓની પણ તેમણે ચર્ચા કરી.

તેમણે કહ્યું કે, ઘણાં ઇન્ટરનેશનલ કન્વેશન પણ તેને અસર કરે છે. વીમાની પતાવટ સરળતાથી થાય એ માટે તેમણે વીમેદારની ફરજો પર ભાર મૂક્યો હતો અને કહ્યું કે વીમો એ કરાર છે અને 'અટમોસ્ટ ગુડ ફેથ' તેનો પાયાનો સિદ્ધાંત છે. આ સિદ્ધાંત મુજબ, વીમો લેનાર વ્યક્તિ અને વીમો આપનાર કંપની બંનેએ એકબીજાથી કોઈ પણ મહત્વની વિગત છુપાવવી જોઈએ નહીં. ખાસ કરીને વીમો લેનારે જોખમ સાથે જોડાયેલી તમામ સત્ય હકીકતો જાહેર કરવી અનિવાર્ય છે. કાર્ગોની પ્રકૃતિ, પેકેજિંગ અને મુસાફરીના માર્ગ વિશે સાચી માહિતી આપવી એ 'અટમોસ્ટ ગુડ ફેથ'નો ભાગ છે. જો કોઈ મહત્વની માહિતી છુપાવવામાં આવે, તો વીમા કંપની કલેઈમ નકારવાનો અધિકાર ધરાવે છે.

તેમણે ઉદાહરણ સાથે સમજાવ્યું કે, જ્યારે દરિયાઈ મુસાફરી દરમિયાન જહાજ, તેમાં રહેલો સામાન કે ફૂ મેમ્બર્સ પર કોઈ મોટું સંકટ આવે, અને તે સંકટમાંથી બધાને બચાવવા માટે જાણીજોઈને કોઈ ચોક્કસ સામાનનો ત્યાગ કરવામાં આવે અથવા કોઈ વધારાનો ખર્ચ કરવામાં આવે, ત્યારે તે નુકસાન માત્ર એક વ્યક્તિનું નથી ગણાતું. તે નુકસાન તમામ હિતધારકો (જહાજ માલિક અને તમામ કાર્ગો માલિકો) વચ્ચે વહેંચવામાં આવે છે. તેને 'જનરલ એવરેજ કંટ્રિબ્યુશન' કહેવાય છે. જો તમારી પાસે યોગ્ય મરીન ઇન્શ્યોરન્સ પોલિસી હોય, તો 'જનરલ એવરેજ' હેઠળ તમારે આપવો પડતો હિસ્સો વીમા કંપની ચૂકવે છે.

મરીન પોલિસી ફક્ત કાર્ગો જ કવર કરે છે એવું નથી. તેમણે સુએઝ કેનલમાં 2021ના બ્લોકેજનું ઉદાહરણ આપી સમજાવ્યું કે જ્યારે દરિયાઈ મુસાફરી દરમિયાન જહાજ કે કાર્ગો કોઈ ગંભીર જોખમમાં હોય (દા.ત. જહાજ ખડક સાથે અથડાય કે એન્જિન ફેલ થવાને કારણે ડૂબવાની તૈયારીમાં હોય), ત્યારે તેને બચાવવા માટે ત્રીજી વ્યક્તિ કે કંપની દ્વારા જે સેવા આપવામાં આવે છે, તેના બદલામાં ચૂકવવામાં આવતી રકમને સાલ્વેજ ચાર્જીસ કહેવામાં આવે છે. મરીન ઇન્શ્યોરન્સ પોલિસીમાં સાલ્વેજ ચાર્જીસને આવરી લેવામાં આવે છે. જો તમારી પાસે યોગ્ય વીમો હોય, તો વીમા કંપની તમારી વતી આ ચાર્જીસ ચૂકવે છે. સાથે જ તેમણે મરીન પોલિસીના પ્રકારો, કવરેજ, ટ્રાન્ઝિટ ક્લોઝ, કવરેજ ક્યારે શરૂ થાય, ક્યાં સુધી ચાલુ રહે, શું કવર નહીં થાય, સ્પોટ સર્વેની અગત્યતા વગેરે મુદ્દે સમજાવ્યું હતું.

ચેમ્બરના ગ્રુપ ચેરમેન શ્રી નીરવ માંડલેવાલાએ આજના વૈશ્વિક વેપારમાં મરીન ઇન્શ્યોરન્સના મહત્વ અને કાર્યક્રમના ઉદ્દેશ્ય વિશે સમજૂતી આપી હતી.

ચેમ્બરની ઇન્શ્યોરન્સ કમિટીના ચેરમેન શ્રી મેહરનોશ તોડીવાલા દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન, વક્તાનો પરિચય અને આભારવિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે ચેમ્બરના ઓલ એક્ઝિબિશન્સ ચેરમેન શ્રી કિરણ હંમર, ઉદ્યોગકારો, નિકાસકારો, એજન્ટો, સર્વેયરો અને ચેમ્બરના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને મરીન વીમા વિશે પ્રશ્નોત્તરી દ્વારા જાણકારી મેળવી હતી.